

સરકારશ્રીએ શરૂ કરેલ ઓનલાઈન સર્ટિફિકેટ ઓફ ઓરીજનના પોર્ટલમાં નિકાસકારોને પડતી મુશ્કેલીના નિવારણ માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ડીજીએફટી ન્યુ દિલ્હી સમક્ષ રજુઆત કરવામાં આવી...

સરકારશ્રીએ નિકાસકારોને ઓનલાઈન સર્ટિફિકેટ ઓફ ઓરીજન મળી શકે તે માટે કોમન ડિઝીટલ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ઓનલાઈન સર્ટિફિકેટ ઓફ ઓરીજનના પોર્ટલમાં નિકાસકારોને લઘુ ઘણી મુશ્કેલી પડી રહી છે.

- (૧) પોર્ટલમાં કોલમનં.૭ માં નિકાસ કરેલ વસ્તુની વિગત દર્શાવવાની હોય છે. જેમાં એક કરતા વધારે નિકાસ વસ્તુઓના કિસ્સામાં દરેક આઈટમની જરૂરી વિગતો એક જ કોલમમાં ફાળવેલ માર્યાદિત જગ્યામાં દર્શાવી શકાતી નથી. આના વિકલ્પે એક અલગ સ્ટેટમેન્ટમાં તમામ વસ્તુઓની વિગત દર્શાવી CoO ફોર્મમાં કોલમનં.૭ માં સાથે બીડિલ ફોર્મ મુજબ માન્ય રાખવું જોઈએ.
- (૨) CoO ના ફી પેમેન્ટ કરવા માટે કોર્પોરેટ બેન્કીંગનું પ્રાવધાન પોર્ટલમાં કરવું ખાસ જરૂરી છે.
- (૩) CoO ઓનલાઈન જનરેટ કરતી વખતે નિકાસકારોએ નિકાસપાત્ર આઈટમ બનાવવા માટે કરેલ તમામ આયાતોની વિગતો આપવી ખુબ જ અસુવિધાજનક જાણાય છે અને સમયનો વ્યય પણ થાય છે. જેનું તાત્કાલીક નિવારણ લાવવું.
- (૪) CoO ના ચાર્જ પેટે એક પેઈઝ દીઠ રૂ.૨૩૬/- ફી નિર્ધારિત કરાયેલ છે. પરંતુ બે કે ત્રણ પેઈઝના કિસ્સામાં દરેક પેઈઝ દીઠ રૂ.૨૩૬/- ભરવાપાત્ર થાય છે. સદર જોગવાઈ તાત્કાલીક સુધારી પેઈઝ વાઈઝને બદલે CoO વાઈઝ રૂ.૨૩૬/- ફી લઈ શકાય તેવી વ્યવસ્થા કરવી.
- (૫) નિકાસકાર સિસ્ટમમાં ઈનવોઈસ અટેસ્ટેડ કરાવી શકે તેવી સુવિધા આપેલ છે. પરંતુ અન્ય સહાયક ડોક્યુમેન્ટ જેવા કે પેકિંગ લીસ્ટ વગેરે અટેસ્ટેડ માટે જોગવાઈ થયેલ નથી. તેથી નિકાસકાર તમામ ડોક્યુમેન્ટ અટેસ્ટેડ કરી શકે તેવી વ્યવસ્થા કરવી.
- (૬) નિકાસકાર માટે ફાઈનલ રેસ્ટ્રીનેશન (અંતિમ સ્થળ) દેશ દર્શાવવાનું હોય છે. જે માટે ચેક લીસ્ટ પ્રોવાઈડ કરવામાં આવેલ છે. પરંતુ ચેકલીસ્ટમાં સામેલ ન હોય તેવા દેશમાં નિકાસના કિસ્સામાં જે તે દેશનું નામ સીસ્ટમ માન્ય રાખતી નથી. આવા સંજોગોમાં અન્ય ઓપ્શનનું પ્રાવધાન તાત્કાલીક કરવાની જરૂર છે. વિગેરે બાબતે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ન્યુ દિલ્હી ડીજીએફટીશ્રી અમિત યાદવ સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.